

**AP-115**  
**May-2016**  
**M.A., Sem.-II**  
**407 : Economics**  
**(Micro Economics-II)**

Time : 3 Hours]

[Max. Marks : 70

1. પરિવર્તનશીલ સાધન સંયોજનનો નિયમ સમજાવો અને ઘટતા વળતરના નિયમનું મહત્વ સમજાવો. 14  
**અથવા**  
 (અ) ખર્ચનો પ્રણાલીકાગત સિદ્ધાંત ચર્ચો. 7  
 (બ) સમઉત્પાદન વક્રના લક્ષણો સમજાવો. 7
2. ઈજારાયુક્ત હરિફાઈના લક્ષણો જણાવો. ઈજારાયુક્ત હરિફાઈ હેઠળ પેઢીની ટૂંકાગાળાની સમતુલા સમજાવો. 14  
**અથવા**  
 (અ) પૂર્ણ હરિફાઈ અને ઈજારા હેઠળ પેઢીની સમતુલાની તુલના કરો. 7  
 (બ) કિંમત ભેદભાવ હેઠળ પેઢીની સમતુલા સમજાવો. 7
3. અલ્પહસ્તક ઈજારાનું ખાંચાવાળી માંગરેખાનું મોડેલ સમજાવો. 14  
**અથવા**  
 બોમલનું મહત્તમ વેચાણ આવકનું મોડેલ ચર્ચો.
4. ભાડાનો અર્થ આપો અને ભાડાનો આધુનિક સિદ્ધાંત ચર્ચો. 14  
**અથવા**  
 (અ) નફાના કોઈપણ બે સિદ્ધાંતો સમજાવો. 7  
 (બ) યુલર પ્રમેય વિશે ટૂંકનોંધ લખો. 7
5. નીચે દર્શાવેલ દરેક પ્રશ્ન માટે શ્રેષ્ઠ જવાબ લખો : 14  
 (1) કયા પ્રકારના બજારમાં  $MR = MC = AR = AC$  શક્ય હોય છે ?  
 (a) ઈજારાયુક્ત હરિફાઈ (b) પૂર્ણ હરિફાઈ  
 (c) ઈજારો (d) ઉપરના બધા જ  
 (2) તૂટક માંગ રેખાનો નીચેનો હિસ્સો સાપેક્ષ રીતે \_\_\_\_\_ હોય છે.  
 (a) વધુ સાપેક્ષ (b) વધુ અનપેક્ષ  
 (c) સંપૂર્ણ અનપેક્ષ (d) સંપૂર્ણ સાપેક્ષ  
 (3) નીચે દર્શાવેલમાંથી કયું પૂર્ણ હરિફાઈવાળા બજારનું લક્ષણ નથી ?  
 (a) સમાનગુણી વસ્તુ (b) સાધનોની સંપૂર્ણ ગતિશીલતા  
 (c) મુક્ત પ્રવેશ નિર્ગમન (d) વસ્તુ વિકલન  
 (4) સમ ઉત્પાદન વક્રની બહિર્ગોળતા બે સાધનો વચ્ચેના \_\_\_\_\_ સીમાંત અવેજીદરને દર્શાવે છે.  
 (a) વધતું (b) ઘટતું  
 (c) સમાન (d) ઉપરના બધા જ

- (5) સમયના લાંબાગાળે ઉત્પાદન અને સાધનોના કદ વચ્ચેના સંબંધને શેના વડે દર્શાવવામાં આવે છે ?
- (a) કદ વળતરના નિયમ  
(b) ઘટતા સીમાંત તુષ્ટીગુણનો નિયમ  
(c) પરિવર્તનશીલ સાધન સંયોજનનો નિયમ  
(d) એકપણ નહિ
- (6) જ્યારે પેઢીને મળતા આંતરિક કરકસરોના લાભોને આંતરિક અલાભ વડે તટસ્થીકૃત કરવામાં આવે ત્યારે કદ વળતર \_\_\_\_\_ હોય છે.
- (a) વધતુ  
(b) ઘટતુ  
(c) સ્થિર  
(d) શૂન્ય
- (7) નીચે દર્શાવેલામાંથી કયો ખર્ચ વક્ર ક્યારેય 'U' આકારનો હોતો નથી ?
- (a) સરેરાશ ખર્ચ વક્ર  
(b) સીમાંત ખર્ચ વક્ર  
(c) સરેરાશ અસ્થિર ખર્ચ વક્ર  
(d) સરેરાશ સ્થિર ખર્ચ વક્ર
- (8) એફ.એમ. નાઈટના મતે નફો \_\_\_\_\_ માટે મળે છે.
- (a) આર્થિક ગતિશીલતા  
(b) નવપ્રવર્તનો  
(c) અનિશ્ચિતતા સહન કરવા  
(d) ઉપરના બધા જ
- (9) નીચેનામાંથી કયુ ઈજારાયુક્ત હરિફાઈ માટે સાચુ નથી ?
- (a) પેઢીઓ વચ્ચે ઉંચી માત્રામાં આંતરઅવલંબન  
(b) વસ્તુ વિકલન  
(c) લાંબા ગાળે સામાન્ય નફો  
(d) વેચાણ ખર્ચ
- (10) કયા અર્થશાસ્ત્રીના મતે મેનેજરો નફાને મહત્તમ કરવાને બદલે પેઢીના વૃદ્ધિના સમતુલીત દરને મહત્તમ બનાવવાનો પ્રયાસ કરે છે ?
- (a) આર. મારીસ  
(b) કુર્નોટ  
(c) બરટ્રન્ડ  
(d) પોલ સ્વીઝી
- (11) સંયુક્ત નફા મહત્તમીકરણવાળા જોડાણમાં સંયુક્ત નફો ત્યારે મહત્તમ બનશે જ્યારે.
- (a) ઉદ્યોગના MR બરાબર ઉદ્યોગનું MC થાય.  
(b) પેઢીના MR બરાબર પેઢીઓનું MC થાય.  
(c) પેઢીના MR બરાબર ઉદ્યોગનું AR થાય.  
(d) ઉપરનું એકપણ નહિ.
- (12) એવી બજાર પરિસ્થિતિ જેમાં અલ્પ સંખ્યામાં પેઢીઓ સમાનગુણી અથવા ભિન્નતાવાળી વસ્તુઓનું વેચાણ કરે છે તે \_\_\_\_\_ રીતે ઓળખાય છે.
- (a) પૂર્ણ હરિફાઈ  
(b) ઈજારો  
(c) અલ્પહસ્તક ઈજારો  
(d) એકપણ નહિ
- (13) ખર્ચ અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ શું કહેવાય છે ?
- (a) ઉત્પાદન વિધેય  
(b) ઉપભોગ વિધેય  
(c) ખર્ચ વિધેય  
(d) એકપણ નહિ
- (14) અલ્પહસ્તક ઈજારાદાર પેઢીઓમાંથી સૌથી દક્ષ સંચાલનવાળી પેઢી પ્રથમ કિંમત ફેરફાર જાહેર કરે અને ઉદ્યોગની અન્ય પેઢીઓ તેનું અનુસરણ કરે તે શું કહેવાય છે ?
- (a) બેરોમેટ્રીક કિંમત નેતૃત્વ  
(b) ઓછા ખર્ચ કિંમત નેતૃત્વ  
(c) પ્રભાવશાળી પેઢી કિંમત નેતૃત્વ  
(d) ઉપરના બધા જ

**AP-115**  
**May-2016**  
**M.A., Sem.-II**  
**407 : Economics**  
**(Micro Economics-II)**

Time : 3 Hours]

[Max. Marks : 70

1. Explain the law of variable proportion and state the importance of law of diminishing returns. 14
- OR**
- (a) Discuss the traditional theory of cost. 7  
 (b) Explain the characteristics of Isoquants. 7
2. State the characteristics of monopolistic competition. Explain the short run equilibrium of a firm under monopolistic competition. 14
- OR**
- (a) Compare the equilibrium of a firm under perfect competition and monopoly. 7  
 (b) Explain firm's equilibrium under price discrimination. 7
3. Explain the Kinky demand curve model of oligopoly. 14
- OR**
- Discuss Bomal's model of sales revenue maximization.
4. Define rent and discuss the modern theory of rent. 14
- OR**
- (a) Explain any two theories of profit. 7  
 (b) Write short note on Euler's theorem. 7
5. For each of the following questions write the best answer : 14
- (1)  $MR = MC = AR = AC$  is possible under  
 (a) monopolistic competition (b) perfect competition  
 (c) monopoly (d) all of the above
- (2) The lower portion of kinked demand curve is relatively  
 (a) more elastic (b) more inelastic  
 (c) perfectly inelastic (d) perfectly elastic
- (3) Which of the following is not the characteristic of perfect competitive market ?  
 (a) homogeneous good (b) perfect mobility of factors  
 (c) free entry exit (d) product differentiation
- (4) The convexity of isoquant shows the marginal rate of substitution between two factors \_\_\_\_\_.  
 (a) increases (b) diminishes  
 (c) same (d) all of the above

- (5) The relationship between outputs and scale of inputs in the long run is shown by
- The law of returns to scale
  - The law of diminishing marginal utility
  - The law of variable proportion
  - none of the above
- (6) When internal economies enjoyed by a firm are neutralized by internal diseconomies, the returns to scale are \_\_\_\_\_.
- increasing
  - decreasing
  - constant
  - zero
- (7) Which of the following cost curve is never 'U' shaped ?
- average cost curve
  - marginal cost curve
  - average variable cost curve
  - average fixed cost curve
- (8) According to Prof. F.M. Knight, profit is received for
- Economic dynamics
  - Innovations
  - Uncertainty bearing
  - all of the above
- (9) Which of the following is not true about monopolistic competition ?
- high degree of interdependence among the firms.
  - product differentiation
  - normal profit in the long run
  - advertising expenditure
- (10) According to which economist managers do not maximise profits but instead they seek to maximise balanced rate of growth of the firm.
- R. Marris
  - Cournot
  - Bertrand
  - Paul Sweezy
- (11) In joint profit maximisation cartel, joint profits will be maximised when
- the industry MR equals the industry MC
  - the firm's MR equal the firm's MC
  - the firm's MR equals the industry AR
  - none of the above
- (12) The market situation in which there are few firms selling homogeneous or differentiated products is known as
- Perfect competition
  - Monopoly
  - Oligopoly
  - None of the above
- (13) The relation between cost and output is called
- production function
  - consumption function
  - cost function
  - none of the above
- (14) The firm among the oligopolistic firms with the wisest management which announces a price change first and then followed by other firms in the industry is known as the
- Barometric price leadership
  - Low cost price leadership
  - Dominant firm price leadership
  - All of the above